

**FOR EXAMPLE**

**Central Zone Community Halls Booking**

<b>Hall Name *</b>	<input type="checkbox"/> Galemendi Community Hall      • <input type="checkbox"/> Rustampura Community Hall <input type="checkbox"/> Salabatpura Multipurpose Hall <input type="checkbox"/> Sagarampura Community Hall <b>(Without Kitchen)</b>				
<b>Program Type *</b>	<input type="checkbox"/> <b>Educational/ Samajik Sanskrutik Karyakram</b> (शैक्षणिक/सामाजिक सांस्कृतिक कार्यक्रम)	<input type="checkbox"/> <b>Religious Lectures</b> (धार्मिक वचन)	<input type="checkbox"/> <b>Seminars</b> (सेमिनार)	<input type="checkbox"/> <b>Marriage/ Reception</b> (लग्न/स्वागत)	<input type="checkbox"/> <b>Business Purpose</b> (बिजनेस हेतु)
	<input type="checkbox"/> <b>Shok-Sabha (without Food &amp; Breakfast) -</b> शोक सभा (फूड अन्ड ब्रेकफ़ास्ट बिना)	<input type="checkbox"/> <b>Annual Meeting</b> (वार्षिक मीटिंग)			
<b>Booking Date *</b>	DD/MM/YYYY				
<b>Floor *</b>	<b>Ground Floor</b> <input type="checkbox"/> <b>First Floor (Without Kitchen)</b> <input type="checkbox"/> <b>Second Floor (Without Kitchen)</b>				
<b>Name of Organization / Applicant *</b>	ABC XYZ OPQ  (Cheque for refund of deposit if any will be issued in above name only)				
<b>Responsible Person *</b>	ABC XYZ OPQ				
<b>Identity Card No. *</b>	XXXX XXXX				
<b>TAN</b>					
<b>GST No.</b>					
<b>Address For Communication *</b>	3/1588, RESHAMWAD, SALABATPURA, SURAT				
<b>City *</b>	SURAT				
<b>State *</b>	GUJARAT				
<b>Email ID *</b>	vasu1234@*****				
<b>Phone No. *</b>	12345678				
<b>Mobile Number *</b>	(1) 990*****99      (2) 85*****99				
<b>Provide Bank Details for Refund Process if any</b>					
<b>MICR Code</b>	395004***				
<b>Bank Account Number</b>	07500*****12				
<b>IFSC Code</b>	BARB0*****				

**Note:**

1. For booking payment must be made in cash/DD/Credit-Debit Card/Pay Order.
2. Advance booking to be considered as 151 days or more and regular booking considered within 150 days.
3. All parties/organizers have to observe the SMC RULES.
3. Passbook Xerox compulsory with this form (for refund process).

Applicant Name & Signature